

Seat No.: _____

Enrolment No. _____

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY
Diploma Engineering - SEMESTER-IV • EXAMINATION – SUMMER 2013

Subject Code: 35403**Date: 02-12-2013****Subject Name: Financial Accounting - III****Time: 10:30 am - 01:00 pm****Total Marks: 70****Instructions:**

1. Attempt all questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. English version is considered to be Authentic.

Q.1 (a) The Trial Balance of Mukesh limited as on 31-03-2004 is as under :**07**

Debit Balance	Rs.	Credit Balance	Rs.
Call in arrears (equity)	10000	10% Preference	
Land & Building	500000	Shares Capital	200000
Plant & Machinery	600000	Equity share capital	400000
Stock (1-4-2004)	100000	Creditors	70000
Purchases	400000	Provident Fund	25000
Vehicles	255000	10% Debentures	400000
Cash and Bank	110000	General Reserve	121500
Wages	24000	Debentures Rodmen Fund	120000
Advertising Expenses	10000	Fixed deposits	100000
Debenture interest	20000	Bills payable	40000
Salaries	152000	Profit and loss A/c. (1-4-2004)	20000
Investments	150000	Sale	1037000
Rent and taxes	15000	Interest on Investments	15000
Carriage inward	8000	Bank loan	100000
Auditor fees	5000		
Debenture redemption Fund	120000		
Preliminary Exp.	20000		
Furniture	37500		
Discount on Debentures	20000		
Debtors	80000		
Directors fees	12000		
	2648500		2648500

From the above information prepare final account of the company as per Company act.

(b) Explain on sinking fund Method.**07****Q.2 (a)** Explain meaning and objectives of Indian Accounting Standards.**07****(b)** S.R. Ltd. Issued 60,000 shares which were under written as follows.**07**

A : 30,000 shares, B : 20,000 shares, C : 10,000 shares.

The underwriters made applications for firm underwriting as follows :

A : 5000 shares, B : 3000 shares, C : 3000 shares

General Reserve	2,00,000
Profit and Loss A/c. (credit)	1,00,000

The Company decided :

To convert partly equity shares into fully paid shares.

To issue bonus shares at Rs. 10 each at a premium of 25% on the basis of one equity share for every five equity shares held.

Pass necessary journal entries in the books of the company.

- (b) Explain the forms of share capital. 07

- Q.4** (a) Mayank Company issued Rs.2,70,000 redeemable preference shares at par on 1st January, 1995 redeemable as the option of the company on or after 21st December 2000 in whole or in part. The following redemptions were made out profits. 07

On 30th June, 2001 Rs. 90,000

On 30th June, 2002 Rs. 60,000

In December 2002 the company issued equity share the face value of Rs.90,000 at a premium of 2% and on 31st December in the same year it is redeemed the balance of preference shares pass the necessary journal enteries to record the transactions.

- (b) Provisions regarding issues of shares in discount. 07

OR

- Q. 4** (a) Modern Co. Ltd. invited applications for 60,000 equity shares each of Rs.10 at a premium of Rs.5/- per share. The authorized capital of the company is of 1,00,000 equity capital shares each of Rs. 10 07

Amount Payable per share is as under :

- (1) On Application Rs. 3/-
- (2) On allotment Rs. 6/- (including premium)
- (3) On first call Rs. 4/-
- (4) On second call Rs. 2/-

The company received full amount up to first call Mr. Amit to whom co. had allotted 1,800 equity shares, fail to pay second call money this shares were forfeited and reissued to Sumit at 20% discount. Record the necessary journal entries in the books of company (narration is not required)

- (b) Explain Vendor's suspense account. 07

- Q.5** (a) The Janak Company Ltd. has the following items in the balance sheet. 07
- Paid up Capital : 1,00,000

(Shares of Rs. 10 each Rs. 8 paid)

General Reserve 1,00,000

Profit and loss account (Credit) 50,000

The company decided

to convert partly paid equity share in to fully paid shares.

To issue bonus share at Rs.10 each on basic of Rs.5 equity share hold.

Pass necessary journal entry in the book of company (narration is not required)

(b) What is underwriting ? Explain the types of underwriting agreements. 07

OR

Q.5 (a) Explain Good will and capital Reserve. 07

(b) Explain Bonus share. 07

ગુજરાતી

પ્રશ્ન. ૧ અ મુકેશ કંપની લી. નુ' તા.૩૧-૩-૨૦૦૪ ના રોજનુ' કાયુ' સરવૈયુ' નીચે મુજબ છે. ૦૭

ઉધાર બાકી	રકમ	જમા બાકીઓ	રકમ
બાકી હપ્તા (ઇકવીટી)	૧૦૦૦૦	૧૦% ના પેફરન્સ શેર મુડી	૨૦૦૦૦૦
જમીન અને મકાન	૫૦૦૦૦૦	ઓડીનરી શેર મુડી	૪૦૦૦૦૦
પ્લાન્ટ અને મશીનરી	૬૦૦૦૦૦	લેણદારો	૭૦૦૦૦
સ્ટોક (૧.૪.૨૦૦૩)	૧૦૦૦૦૦	પોવીડન્ટ ફંડ	૨૫૦૦૦
ખરીદી	૪૦૦૦૦૦	૧૦% ના ડીબે'ચરો	૪૦૦૦૦૦
વાહનો	૨૫૫૦૦૦	સામાન્ય અનામત	૧૨૧૫૦૦
રોકડ અને બેંક	૧૧૦૦૦૦	ડીબે'ચર પરત નીધી	૧૨૦૦૦૦
મજૂરી	૨૪૦૦૦	બા'ધી મુદતની થાપણો	૧૦૦૦૦૦
જાહેરાત ખર્ચ	૧૦૦૦૦	દેવી હુ'ડીઓ	૪૦૦૦૦
ડીબેન્ચર ખર્ચ	૨૦૦૦૦	નફાનુકશાન ખાતુ'	૨૦૦૦૦
પગાર	૧૫૨૦૦૦	(૧.૪.૦૩)	૧૦૩૭૦૦૦
રોકાણો	૧૫૦૦૦૦	વેચાણ	૧૫૦૦૦
ભાડુ અને વેરા	૧૫૦૦૦	રોકાણો ઉપર	૧૦૦૦૦૦
આવકમાલ ગાડા ભાડુ'	૮૦૦૦	બેંક લોન	
ઓડીટરની ફી	૫૦૦૦		
ડીબે'ચર પરતનીધી રોકાણ	૧૨૦૦૦૦		
પાથમીક ખર્ચ	૨૦૦૦૦		
ફનીચર	૩૭૫૦૦		
ડીબે'ચર વટાવ	૨૦૦૦૦		
દેવાદારો	૮૦૦૦૦		
સ'ચાલકોની ફી	૧૨૦૦૦		
	૨૬૪૮૫૦૦		૨૬૪૮૫૦૦

ઉપરની માહિતીના આધારે કંપની ધારા અનુસાર કંપનીના વાર્ષિક હિસાબો

તૈયાર કરો.

બ સીકી'ગ ફ'ડની પધ્ધતીઓ વર્ણવો. ૦૭

પ્રશ્ન. ૨ અ ભારતીય હીસાબી ધોરણોનો અર્થ આપી તેના હેતુઓ વીશે નો'ધ લખો. ૦૭

બ એસ.આર.લી. એ ૬૦૦૦૦ શેર બહાર પાડ્યા અને તેનું નીચે મુજબ અ'ડર રાઇટી'ગ કરવામા' આવ્યું.

અ : ૩૦૦૦૦ શેર, બ : ૨૦૦૦૦ શેર, ક: ૧૦૦૦૦ શેર

પેઢીના અ'ડર રાઇટી'ગ માટે અ'ડર રાઇટરોએ નીચે મુજબ અરજીઓ કરી.

અ: ૫૦૦૦ શેર, બ: ૩૦૦૦ શેર, ક: ૩૦૦૦ શેર

નીચત બા'હેધરી સીવાય પણ સુચક અરજીઓ સહીત કુલ ભરણું ૪૦૦૦૦ શેર માટે થયું.

સુચક અરજીઓ નીચે મુજબ હતી.

અ: ૧૨૦૦૦ શેર, બ: ૧૦૦૦૦ શેર, ક: ૮૦૦૦ શેર

દરેક દલાલની વ્યક્તીગત જવાબદારી નક્કી કરો.

એવી ધારણા છે કે બા'હેધરી દલાલોને નીચત બા'હેધરીની કોઇ રકમ જમા આવવાની નથી.

અથવા

બ શેર પીમીયમના' વૈકલ્પિક ઉપયોગ જણાવો. ૦૭

પ્રશ્ન. ૩ અ વીકાસ બધર્સની પેઢીનો ધ'ધો ખરીદી લેવા ૧.૧.૨૦૦૨ ના રોજ રૂ.૧૦ ના ૧૦૦૦૦ ઇક્વીટી શેરની સત્તાવાર ધ્યાપણથી માધવ ક'પની લી. ની સ્થાપના કરવામા' આવી.

તા.૩૧.૧૨.૨૦૦૧ ના રોજનું પેઢીનું પાકું સરવૈયું

મૂડી - દેવા	રકમ	મીલકત-લેણા'	રકમ
મૂડી :		જમીન મકાન	૪૮૦૦૦
વીકાર ૬૦૦૦૦		પ્લાન્ટ થ'તો	૨૦૦૦૦

સાકાર	૪૦૦૦૦	૧૦૦૦૦૦	સ્ટોક	૨૪૦૦૦
અનામત		૪૦૦૦	દેવાદારો	૨૩૨૦૦
બેંક લોન		૩૦૦૦	રોકાણો	૪૮૦૦
લેણદારો		૨૨૦૦૦	લેણી હુડી	૬૪૦૦
દેવી હુડી		૭૦૦૦	બેંક	૮૬૦૦
		૧૩૬૦૦૦		૧૩૬૦૦૦

ધ'ધાની ખરીદીની શરતો નીચે પમાણે હતી.

૧) બેંક લોન સીવાય બધી જ જવાબદારી ક'પનીએ સ્વીકારી પેઢીનું વીસર્જન ખર્ચ રૂ.૧૦૦૦ ક'પનીએ ભોગવવાનો છે અને મીલકતો ચોપડે દર્શાવેલ કી'મતે લેવી.

૨) ધ'ધાની ખરીદ કી'મત પેટે પુરેપુરા ભરાયેલા ૫૦૦૦ ઇકવીટી શેર ૨૦% પીમીયમે, ૬% ના રૂપીયા ૫૦૦૦૦ ના ડીબેન્યર અને બાકીની રકમ રોકડમા' ચુકવવાની છે.

ક'પનીનાચોપડે જરૂરી આમ નોંધ લખી ક'પનીનું પાકું સરવૈયું તૈયાર કરો.

બ ઉભા નાણા' પત્રકો બનાવવાના ઉદ્દેશો જણાવો.

૦૭

અથવા

પ્રશ્ન. ૩ અ એ.બી.સી. ક'પની લી. ના પાકા સરવૈયાની કેટલીક વીગતો નીચે મુજબ છે.

૦૭

ભરપાઇ થયેલી ઇકવીટી શેર મુડી ૨૦૦૦૦૦

(શેરની કી'મત રૂ.૧૦ દરેક રૂ.૮ લેખે ભરપાઇ થયેલ)

સામાન્ય અનામત ૨૦૦૦૦૦

નફા નુકશાન ખાતું (જમા બાકી) ૧૦૦૦૦૦

કંપનીએ નીર્ણય કયો કે,

૧) અર્ધ ભરપાઈ ઇકવીટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા

૨) કંપનીએ દર પા'ચ ઇકવીટી શેર દીઠ એક શેર રૂ.૧૦ ની મુળ કી'મતનો ૨૫% પીમીયમથી આપવાનું ઠરાવ્યું.

કંપનીના ચોપડે યોગ્ય આમ નોંધ લખો.

બ શેરમુડીના' સ્વરૂપો વર્ણવો.

૦૭

પ્રશ્ન. ૪ અ તા.૧.૧.૯૫ ના રોજ મય'ક કંપનીએ રૂ.૨૭૦૦૦૦ ની મુળ કી'મતે રીડીમેબલ ૦૭

પેફરન્સ શેર બહાર પાડ્યા આ શેર તા.૩૧.૧૨.૨૦૦૦ ના રોજ કે તે પછી પુરા અથવા આ'શીક રીતે પરત કરવા પાત રહેશે.

નફામા'થી નીચે મુજબ રીડીમેબલ પેફરન્સ શેર પરત કરવામા' આવ્યા.

તા.૩૦.૬.૨૦૦૧ ના રોજ રૂ.૮૦૦૦૦

તા.૩૦.૬.૨૦૦૨ ના રોજ રૂ.૬૦૦૦૦

ડીસેમ્બર ૨૦૦૨ મા' કંપનીએ ૨ ટકા પીમીયમથી રૂ.૮૦૦૦૦ ના ઇકવીટી શેર બહાર પાડ્યા અને ૩૧.૧૨.૨૦૦૨ ના રોજ બાકીના રીડીમેબલ પેફરન્સ પરત કર્યા.

ઉપર વ્યવહારોની આમનોંધ લખો.

બ વટાવથી શેર બહાર પાડવાની જોગવાઈઓ જણાવો.

૦૭

અથવા

પ્રશ્ન. ૪ અ ધી મોર્ડન ક'. લી. એ ૬૦૦૦૦ ઇકવીટી શેર દરેક રૂપીયા ૧૦ ના, રૂ.૫ ના ૦૭

પીમીયમથી બહાર પાડી શેર અરજીઓ મ'ગાવી. કંપનીની સત્તાવાર મુડી એક લાખ ઇકવીટી શેર દરેક રૂપીયા ૧૦ ની બનેલી છે. શેર દીઠ રકમ નીચે પમાણે મ'ગાવવામા' આવી.

૧) શેર અરજી ઉપર રૂ.૩

૨) શેર મંજૂરી ઉપર રૂ.૬ (પીમીયમ સહીત)

૩) શેર પથમ હપ્તા ઉપર રૂ.૪

૪) શેર બીજા હપ્તા ઉપર રૂ. ૨ કંપનીને પથમ હપ્તા સુધીની પુરેપુરી રકમ મળી હતી. શ્રી અમીત કે જેમને કંપનીએ ૧૮૦૦ શેર ફાળવ્યા હતા'. તેઓ શેરના બીજા હપ્તાના નાણા' ભરી શક્યા નહી' તેમના બધા શેર જપ્ત કરીને ૨૦% વટાવથી કંપનીને સુમીતને બધા શેર પુરેપુરા ભરપાઇ ગણીને ફાળવ્યા છે. કંપનીના ચોપડે જરૂરી આમનો'ધ લખો. (બા.જે. ની જરૂર નથી)

બ ધ'ધો વેચનારનું ઉપલક ખાતું વર્ણવો. ૦૭

પ્રશ્ન. ૫ અ જનક કંપની લી. ના પાકા સરવૈયાની કેટલીક વીગતો નીચે મુજબ છે. ૦૭

ભરપાઇ થયેલ ઇકવીટી શેર મુડી ૧૦૦૦૦૦

(શેરની કીમ'ત રૂ.૧૦ નો એક એવા રૂ.૮ લેખે ભરપાઇ થયેલ.)

સામાન્ય અનામત ૧૦૦૦૦૦

ન.નુ. ખાતું (જમા બાકી) ૫૦૦૦૦

કંપનીએ નીર્ણય કર્યો કે,

૧) અર્ધ ભરપાઇ ઇકવીટી શેરને પુર્ણ ભરપાઇ કરવા

૨) કંપનીએ દર પા'ચ ઇકવીટી શેર દીઠ એક બોનસ શેર રૂપીયા ૧૦ ની મુળ કી'મતે આપવાનું ઠરાવ્યું.

ઉપરોક્ત માહિતીના આધારે કંપનીના ચોપડે જરૂરી આમનો'ધ લખો.

(બા.જે. ની જરૂર નથી)

બ બા'હેધરીનો અર્થ આપી બા'હેધરી કરારના પકારો વીશે નો'ધ લખો. ૦૭

અથવા

પ્રશ્ન. ૫ અ પાઘડી અને મુડી અનામત વીશે વર્ણન કરો. ૦૭

બ બોનસ શેર વીશે સવીસ્તાર નો'ધ લખો. ૦૭
